



# GOVERNMENT POLYTECHNIC FOR GIRLS

કન્યાઓ માટેની સરકારી પોલીટેકનીક  
कन्याओं के लिये सरकारी पोलिटेकनीक



Opp. Physical Research Laboratory, AHMEDABAD-380 005. Guj. (India) Phone : +91-079-26301581

જીજીપી/એ.આઈ/2022/635

તા. ૯/૧૧/૨૦૨૨

કચેરી આદેશ:

બીજા આદેશ ના થાય ત્યાં સુધી અત્રે ની સંસ્થા ખાતે ચાલુ શૈક્ષણિક સત્રો માં CTE- ઈન્સ્ટ્રક્શનલ મેન્યુઅલ મુજબ શૈક્ષણિક કાર્યનું ચૂસ્ત અને નિયમીત નિરિક્ષણ થાય તે હેતુથી સંસ્થાના એકેડેમીક સેલ હેઠળ નીચે દર્શાવેલ કોષ્ટક મુજબ સબ કમિટીઓ ની રચના કરવામાં આવે છે. સદર સબ કમિટીઓ એ કોષ્ટક મુજબ જે તે વિભાગના શૈક્ષણિક કાર્ય તથા શૈક્ષણિક કાર્ય ને લગતી બાબતો નું નિરિક્ષણ કરવા આથી આદેશ કરવામાં આવે છે. સદર બાબત નું રિપોર્ટીંગ ચેરપર્સન દ્વારા સંસ્થાના એકેડેમીક સેલ ને કરવાનું રહેશે.

વિભાગ	ચેરપર્સન	મેમ્બર સેક્રેટરી	મેમ્બર
આર્કિટકચર આસી.	Sh. H S PATEL I/C HOD CIVIL	Smt. H.P.CHAUHAN Sr. LIT	Smt. J.H.SUTHAR LBME
સી.ડી.ડી.એમ	Sh. N A FATAK HOD IT	Smt. R.K.IYER Sr. LEE	Smt .F P AMBALIA Sr. LDAA
સિવિલ એન્જી.	Smt. P.M. PUROHIT I/C HOD General	Smt. R O YADAV Sr. LCDDM	Sh. P.G.KALARIA LEC
કોમ્પ્યુટર એન્જી.	Dr.F V KUGASHIYA HOD CDDM	Sh.M M SAVARKUNDALAVALA Sr. LCE	Smt. R.D.PAREKH LIT
જનરલ અને બાયોમેડીકલ	Sh .N R MERCHANT SR LEC	Smt.D B THAKKAR Sr. LCACDDM	Smt.D S SINGH LComp.
ઈ.સી.	Sh. H R PARMAR HOD COMPUTER	Smt. B K PATEL Sr. LCACDDM	Smt. S K SHAH LDAA
આઈ.ટી.	Sh. T.P.CHANPURA HOD EC	Sh.R D MOTKA I/C HOD BIO	Smt. J.J.KARAGTHALA LComp.

આચાર્ય.

જી.જી.પી અમદાવાદ

નકલ રવાના : ઉપરોક્ત દરેક અધિકારી ને જરૂરી જાણ અને કાર્યવાહી કરવા સારું.

## ***IQAC GUIDELINES.....***

### ***IQAC shall evolve mechanisms and procedures for***

- a) Ensuring timely, efficient and progressive performance of academic, administrative and financial tasks;
- b) Relevant and quality academic/ research programmes;
- c) Equitable access to and affordability of academic programmes for various sections of society;
- d) Optimization and integration of modern methods of teaching and learning;
- e) The credibility of assessment and evaluation process;
- f) Ensuring the adequacy, maintenance and proper allocation of support structure and services;
- g) Sharing of research findings and networking with other institutions in India and abroad.

### **Functions**

#### ***Some of the functions expected of the IQAC are:***

- a) Development and application of quality benchmarks
- b) Parameters for various academic and administrative activities of the institution;
- c) Facilitating the creation of a learner-centric environment conducive to quality education and faculty maturation to adopt the required knowledge and technology for participatory teaching and learning process;
- d) Collection and analysis of feedback from all stakeholders on quality-related institutional processes;
- d) Dissemination of information on various quality parameters to all stakeholders;
- e) Organization of inter and intra institutional workshops, seminars on quality related themes and promotion of quality circles;
- f) Documentation of the various programmes/activities leading to quality improvement;
- g) Acting as a nodal agency of the Institution for coordinating quality-related activities, including adoption and dissemination of best practices;
- h) Development and maintenance of institutional database through MIS for the purpose of maintaining /enhancing the institutional quality;
- i) Periodical conduct of Academic and Administrative Audit and its follow-up
- j) Preparation and submission of the Annual Quality Assurance Report (AQAR) as per guidelines and parameters of NAAC.

### **Benefits**

#### ***IQAC will facilitate / contribute to***

- a) Ensure clarity and focus in institutional functioning towards quality enhancement;
- b) Ensure internalization of the quality culture;
- b) Ensure enhancement and coordination among various activities of the institution and institutionalize all good practices;
- c) Provide a sound basis for decision-making to improve institutional functioning;
- d) Act as a dynamic system for quality changes in HEIs;
- e) Build an organized methodology of documentation and internal communication.

  
12/3  
2020

Principal, GPG, Ahmedabad